

SHALBY LIMITED

•Passion•Compassion•Innovation•

Shalby/SE/2023-24/107

February 8, 2024

The Listing Department
National Stock Exchange of India Ltd
Mumbai 400 051.

Corporate Service Department
BSE Limited
Mumbai 400 001.

Scrip Code : SHALBY

Through : <https://neaps.nseindia.com/NEWLISTINGCORP/>

Scrip Code: 540797

Through : <http://listing.bseindia.com>

Sub: Submission of Newspaper publication of Unaudited Financial Results (Standalone and Consolidated) for quarter and nine months ended December 31, 2023 - Regulation 30 and 47 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015

Dear Sir / Madam,

Pursuant to Regulation 30 and 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, please find enclosed herewith the copies of advertisement published on February 8, 2024 in Financial Express (English and Gujarati) for Unaudited Financial Results (Standalone and Consolidated) for the quarter and nine months ended December 31, 2023.

You are requested to take the same on your record.

Thanking you,

Yours sincerely
For **Shalby Limited**

Tushar Shah
AVP & Company Secretary
Mem. No: FCS-7216

Encl.: as above

SHALBY LIMITED

Regd. Office: Opp. Karnavati Club, S. G. Road, Ahmedabad - 380 015, Gujarat, India.

Tel: 079 40203000 | Fax: 079 40203109 | info.sg@shalby.org | www.shalby.org

CIN: L85110GJ2004PLC044667

AXIS BANK
 Branch Office: Axis Bank Limited, Collection Center, First Floor, Unit No. 101 & 102 (Part) Baleshwar Avenue S G Highway Opp. Rajpath Club Bodakdev Ahmedabad Gujarat - 380 054. Corporate Office: Axis Bank Ltd., 3rd Floor, Gigaplex, NPC - 1, TTC Industrial Area, Mugalsan Road, Airoli, Navi Mumbai - 400 708.
 Registered Office: "Trishul", 3rd Floor Opp. Samarsheshwar Temple Law Garden, Ellis bridge Ahmedabad - 380006.

E-AUCTION SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTY
 E-Auction Sale Notice for Sale of Immovable Assets under Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 read with proviso to Rule 8(6) of the Security Interest (Enforcement) Rule, 2002

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable property is mortgaged / charged to the secured creditor, the Physical Possession (as detailed below) of which has been taken by the Authorized Officer of Secured Creditor will be sold on "As is where is", "As is what is" and "Whatever there is" on **27th February, 2024** between 11.00 A.M and 12.00 Noon (Last Date and Time for submission on bids is **26th February, 2024** before 4.00 PM) for recovery of the amount (Shown below in respective column) due to the Axis Bank secured creditor from respective borrower(s) and Guarantor(s) shown below. The Reserve Price and the Earnest Money deposit of respective properties as shown below in respective column for recovery of the amount (Shown below in respective column) due to the Axis Bank secured creditor from respective borrower(s) and Guarantor(s) shown below. The Reserve Price and the Earnest Money deposit of respective properties as shown below in respective column;

Sr No	Name of Borrower / Mortgagor and Branch	Description of Property / House / having Total Area about	Reserve Price	EMD Price	Bid Incremental	Outstanding Dues (in Rs.)	Contact Person
1	1.M/S. V.I. PATEL AND CO. (BORROWER) 2. JAGRUBEN ISHWARLAL PATEL (PARTNER / GUARANTOR) 3. VIJAYBHAI PATEL (PARTNER / GUARANTOR / MORTGAGOR) 4. REKHABEN VIJAYBHAI PATEL (GUARANTOR / MORTGAGOR) (Loan Account No. 91403000774350)	ALL THAT PIECE AND PARCEL OF NA PROPERTY BEARING PLOT NO.20, ITS CITY SURVEY NO. 2159, ADM 378.44 SQ. MTRS, TOGETHER WITH ADDITIONAL LAND ADM 133.19 SQ. MTRS. AT GURUKRUPA CO OPERATIVE HOUSING SOCIETY LTD., SITUATED ON THE LAND BEARING R. S. NO. 64 AND 7/A 1 1 1, T. P. SCHEME NO. 5, F. P. NO. 112, CITY SURVEY WARD NO. 13, CITY SURVEY NO. 237, 238/A, AND 239/B OF VILLAGE ATHWA, SUB DISTRICT CHORYASI, DIST. SURAT, IN THE NAME OF REKHABEN VIJAYBHAI PATEL AND KARAN VIJAYBHAI PATEL.	Rs. 4,72,00,000/- (Rupees four crore seventy two lacs only)	Rs. 47,20,000/- (Rupees Forty Seven Lakh Twenty Thousand Only)	In the multiply of Rs. 1,00,000/- (Rupees One Lakh Only)	Rs. 5,28,48,083.17/- (Rupees Five Crore Twenty Eight Lakhs Forty Eight Thousand Eighty Three And Seven-teen Paise Only) being the amount due as on 02-11-2019 (This amount includes interest applied till 30-04-2019)	Name :- Mr. Darshan Trivedi Mobile No:- +91-9978953003 Email ID :- darshan.trivedi@axisbank.com OR Name :- Mr. Sagar Kotecha Mobile No:- +91-9909799027 Email ID:- sagar.kotecha@axisbank.com

For detailed terms and conditions of the sale, please refer to the link provided in the secured creditor's website i.e. <https://www.axisbank.com/auktion-retail> and the Bank's approved service provider M/S C1 India Private Limited at their web portal <https://www.bankauctions.com>. The auction will be conducted online through the Bank's approved service provider M/S C1 India Private Limited at their web portal <https://www.bankauctions.com>. For any other assistance, the intending bidders may contact below authorized officers between 11:30 a.m. to 3:00 p.m. The bid is not transferable. This Notice should be considered as 15 Days' Notice to the Borrowers under Rule 8(6) of the Security Interest (Enforcement) rule, 2002.

Date: 08-02-2024
 Place: Gujarat
 Authorised Officer, Axis Bank Ltd.

Aji Industrial Estate Branch : Rajkot Region
 Shreeji Estate, Nr. Field Marshal, 80 Feet Road, Rajkot - 360003

Bank of Baroda

Auction of Seized Vehicle

Following Vehicles are seized and to be sold on "As is where is" and "As is What is" and "Without Recourse Basis" Condition for Realization of the Secured debts due to Bank of Baroda. The Sale will be done by the undersigned through E-Auction Platform provided at the Website : <https://bob.auctiontiger.net>.

Vehicle Auction Date : 26.02.2024, Time : 02.00 to 04.00 | Vehicle Inspection Date : 20.02.2024, Time : 11.00 AM 04.00 PM | Contact : Romesh Kumar Mishra - 96876 96012

Sr.	Branch	Name of Borrowers	Vehicle Details	Dues Rs. (In Lakhs)	Reserve Price EMD Bid Increase Amt	EMD Collection Account No.	IFSC Code	Contact Person Name & No.
1	Aji Industrial Estate	Mr. Vijay H. Asodiya	Movable Asset, Maruti Suzuki Wagon R VXi CNG GJ25AA5210 Engine No. K10CNC093656 Chassis No. MA3JMTB1SNE696430, Model : 2022	6.47	Rs. 4,90,000 Rs. 49,000 Rs. 10,000	Ac. No. 17400015181219	BARB0AJIRAJ	Romesh Kumar Mishra Mo. 96876 96012

(1) For Detailed and Conditions of the Sale, Please refer to the Link provided in Bank of Baroda, Official Portal Website i.e. www.bankofbaroda.com/webcast.html (2) The Auction-cum-Sale shall be conducted through e-Auction mode only, through the official portal of <https://bob.auctiontiger.net> (3) The intending bidders are advised to go through the portal <https://bob.auctiontiger.net> for detailed terms and conditions for e-Auction Sale before submitting their bids and taking part in the e-Auction sale proceeding and contact the respective Authorized Officer for the concerned Vehicles as mentioned above.

Date: 07.02.2024
 Place : Rajkot
 Authorised Officer, Bank of Baroda

AXIS BANK
 Collection, 1st Floor Baleshwar Avenue, S G Highway, Opp Rajpath Club, Bodakdev, Ahmedabad, Gujarat - 380054.

POSSESSION NOTICE
 APPENDIX -IV [Rule 8(1)]

Whereas, the undersigned being the Authorized Officer of the AXIS BANK LTD, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(2) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice dated mentioned herein below table calling upon the Borrower/Co-Borrower/Mortgagor/Guarantor, mentioned herein below table to repay the amount mentioned hereunder in the notice as mentioned in the said notice together with further interest at the contractual rate on the aforesaid amount and incidental expenses, costs, charges etc. incurred to be incurred, within 60 days from the date of the said notice.

Borrower/Co-Borrower/Mortgagor/Guarantor, mentioned herein below table having failed to repay the Banks dues as mentioned in the notice issued to him under Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, notice is hereby given to the Borrower and other mentioned herein above in particular and the public, in general, that the undersigned has taken Possession (mentioned herein below table) of the property described herein below in exercise of powers conferred on him under section 13(4) of the said Act read with rule 3 of the said Rules on following date.

Borrower/Co-Borrower/Mortgagor/Guarantor mentioned herein below table in particular, and the public, in general, are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the AXIS BANK LTD for an amount mentioned herein below table as mentioned in the said notice together with further interest at the contractual rate on the aforesaid amount and incidental expenses, costs, charges etc. incurred to be incurred.

The Borrowers attention is invited to the provisions of sub Section (8) of Section 13 of the SARFAESI Act, 2002 in respect of time available, to redeem the secured assets

Name of Borrower/ Guarantor Co-Borrower	Demand Notice Date & O/s. Amount Rs. (Interest + Charges - Recovery)	Schedule of Immovable Property	Date & Type of Possession
(1) Panchal Kalpeshbhai (2) Panchal Jayendrakumar Babulal	23-06-2020 Rs. 15,76,971/- as on 17-06-2020	All the pieces & parcel of Flat No. I-506, on 5th Floor, of Block No. I in Residential scheme known as "VISHALA LANDMARK", having built up area of Flat adm 40.06 Sq.Mtrs with undivided common road and land area adm. 19.14 Sq.Mtrs on NA land bearing Survey No. 42/2, F.P. No. 86 of TP Scheme No. 111 lying and being at mouje Village-Nikol, Taluka, Valva, Registration Dist. Ahmedabad-12 (Nikol) As Follow : SURROUNDING :- NORTH: Flat No. I-505, SOUTH : Block-J, EAST: Flat No. I-501, WEST: Block-H	06-02-2024 (PHYSICAL)
(1) DAYABHAI JIVABHAI VEKRIYA (2) NAYABEN DAYABHAI VEKRIYA (3) RAVI DAYABHAI VEKRIYA	05-01-2022 Rs.40,44,728.99/- & Rs. 6,35,931.24/- for Loan A/c No. 918030008773367 & 918030008773396 as on 29-12-2021	ALL THAT PIECES AND PARCELS OF THE IMMOVABLE NA PROPERTY BEARING PLOT NO. 45 ADM. 79.46 SQ. MTS. ALONG WITH UNDIVIDED SHARE IN THE LAND OF ROAD & C.O.P. IN "AIKUNTH DHAM SOCIETY" SITUATE AT REVENUE SURVEY/BLOCK NO. 159/1/1+164, T.P.S. NO. 19 (KATARGAM), F.P. NO. 45 OF VILLAGE KATARGAM, CITY OF SURAT OF THE SAID PROPERTY ARE BOUNDED AS UNDER: EAST: PLOT NO. 40, WEST: ROAD, NORTH: PLOT NO. 46, SOUTH: PLOT NO. 44	01-02-2024 (SYMBOLIC)
(1) NITINBHAI LALJIBHAI VIRPARA (2) ANILBHAI LALJIBHAI VIRPARA (3) JAYABEN LALJIBHAI VIRPARA	10-07-2021 Rs. 3067677/- as on 08-07-2021	ALL THAT PIECES AND PARCEL OF IMMOVABLE PROPERTY COMPRISING OF A RESIDENTIAL TENEMENT CONSTRUCTED ON NA LAND AREA 163-65 SQ. MTRS. OF PLOT NO. 05, LYING AND SITUATED AT R.S. NO. 283 PAKI OF AMRELI HAVING CITY SURVEY NO. 249/A/5 OF AMRELI CITY AT AMRELI, TA. AMRELI, DIST. AMRELI IN THE NAME OF JAYABEN LALJIBHAI VIRPARA AND BOUNDED AS UNDER: SURROUNDINGS: NORTH : ROAD, SOUTH : LAND OF PLOT NO. 6, EAST : ROAD, WEST : LAND OF PLOT NO.04	06-02-2024 (PHYSICAL)

Please further note that as mentioned in sub-section 13 of Sec. 13 of the aforesaid Act, you shall not transfer by way of sale, lease or otherwise any of the assets stated under security referred to in this Notice without prior written consent of our Bank.

Date: 08-FEB-2024 Place: Gujarat
 Sd/- Authorised Officer, Axis Bank Ltd.

SHALBY LIMITED
 Regd. Office : Shalby Multi-Specialty Hospitals, Opp. Karnavati Club, S. G. Road, Ahmedabad 380015, Gujarat, India • Tel: 079 40203000 Fax: 079 40203120
 E-mail: companysecretary@shalby.in website: www.shalby.org CIN: L85110GJ2004PLC044667 • Passion=Compassion=Innovation

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED DECEMBER 31, 2023
 (₹ in million, except per share data)

Sr. No.	Particulars	Standalone		Consolidated			
		Quarter ended		Quarter ended		Nine Months ended	
		31/12/2023	31/12/2022	31/12/2023	31/12/2022	31/12/2023	
1	Total income from operations	1,951.53	1,758.67	6,233.60	2,160.47	2,024.60	6,895.16
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/ or Extraordinary items)	384.79	285.58	1,257.94	308.11	235.35	1,064.12
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/ or Extraordinary items)	384.79	285.58	1,257.94	308.11	235.35	1,064.12
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/ or Extraordinary items)	247.24	191.95	812.85	190.64	152.73	674.59
5	Total Comprehensive Income for the period (after tax) and Other Comprehensive Income (after tax)	247.88	191.21	814.78	190.65	153.15	673.61
6	Paid-up Equity Share Capital (Face Value ₹ 10/- each) (Net of Treasury Shares)	1,073.53	1,073.10	1,073.53	1,073.53	1,073.10	1,073.53
7	Reserves (excluding Revaluation Reserve)	-	-	-	-	-	-
8	Earnings Per Share (Face Value of ₹ 10/- each) (not annualized)						
	(I) Basic EPS	2.30	1.79	7.57	1.78	1.42	6.28
	(II) Diluted EPS	2.30	1.78	7.57	1.78	1.41	6.28

Notes:
 1. The above is an extract of the detailed format of unaudited financial results for the quarter ended December 31, 2023, filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Standalone and Consolidated Financial Results for the quarter ended December 31, 2023 are available on the websites of the Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com and on the Company's website at www.shalby.org.

For and on behalf of Board of Directors
 Dr. Vikram Shah
 Chairman and Managing Director
 DIN: 00011653

Place: Ahmedabad
 Date: February 7, 2024

यूनियन बैंक Union Bank of India

SALE NOTICE : E-AUCTION (RULE 8(6) & 9(1) OF SECURITY INTEREST (ENFORCEMENT) RULES 2002)

WHEREAS the following parties have availed credit facilities from Union Bank of India, and has defaulted to pay and is due to the Bank for the amount mentioned hereunder, plus further interest, costs and charges. Therefore, Union Bank of India in exercise of the powers conferred u/s 13 of The Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 54 of 2002 has decided to sell the property detailed below in public auction to be conducted by way of e-auction through the website/portal detailed hereunder :

Sr	Borrower / Guarantor / Mortgagor	Date of Demand notice u/s 13(2)	Date of Possession notice u/s 13(4)	Encumbrances Known	Amount Mentioned in Demand Notice	Reserve Price in Lacs	EMD 10% in Lacs	Bid Multiples
1	Borrower / Guarantor / Mortgagor : 1. Ms. Chanda Kailash Chaudhary (Borrower / Mortgagor), 143 Laxmikrupa Society Near Chandra Moli School Vejalpur, Ahmedabad, Gujarat 380015. 2. Mr. Chaudhary Kailash Kumar Bansilalji (Co-Borrower / Mortgagor), 143 Laxmikrupa Society Nr Vastrapur Rly, Station Ahmedabad, Gujarat 380015	13.09.2023	05.12.2023	Nil	Rs. 4,90,305.06	Rs. 9.15	Rs. 0.92	Rs. 10,000/-
Description of property : Description of immovable secured assets to be Sold All That Piece & Parcel of Flat No. C/3/G/7 adm. about 35.75 sq. mtrs. of Super Built Up area together with proportionate share in the share land lying N.A. land known as "Shivalay Apartment" Part-4 in the "Ashutosh Co. Op. Housing Soc. Ltd." situated on Sy. No. 762 of Village Vejalpur, Tal. City, Dist. Ahmedabad and Reg. Sub. Dist. Ahmedabad - 10 (Vejalpur) and bounded by (as per valuation report) : East: Passage & Flat no. G-2 West: Open Space, North: Flat no. G-8, South: Flat no. G-6 Property owner's: Ms. Chanda Kailash Chaudhary & Mr. Chaudhary Kailash Kumar Bansilalji		Name & Address of Branch Prahladnagar Branch Address : Riviera Arcade, Near AUDA Garden, 100 Ft. Road, Prahladnagar, Ahmedabad - 380051 Mail Id : Ubin0557790@unionbankofindia.bank						
2	Borrower / Guarantor / Mortgagor : (1). Smt Anjanaba Dineshsinh Zala (Wife & Legal Heir of deceased Shri Dineshsinh Kubersinh Zala) 10 Somnath Nagar Society, Nr Sanghvi High School, Naranpura, Ahmedabad-380013 Also Residing at, 5/30 Vijaynagar Flat, Naranpura, Ahmedabad-380013 (2). Smt Suryaben Kubersinh Darbar (Mother & Legal Heir of deceased Shri Dineshsinh Kubersinh Zala) 10 Somnath Nagar Society, Nr. Sanghvi High School, Naranpura, Ahmedabad-380013 Also Residing at, 5/30 Vijaynagar Flat, Naranpura, Ahmedabad-380013 (3) Smt Harshlekha Dineshsinh Zala (Daughter & Legal Heir of deceased Shri Dineshsinh Kubersinh Zala) 10 Somnath Nagar Society, Nr Sanghvi High School, Naranpura, Ahmedabad -380013 Also Residing at, 5/30 Vijaynagar Flat, Naranpura, Ahmedabad-380013 (4) Ms. Brinda Dineshsinh Zala (Daughter & Legal Heir of deceased Shri Dineshsinh Kubersinh Zala) 10 Somnath Nagar Society, Nr. Sanghvi High School, Naranpura, Ahmedabad-380013 Also Residing at, 5/30 Vijaynagar Flat, Naranpura, Ahmedabad-380013 (5) Mr Pravinshinh Kubersinh Zala (Guarantor) 10 Somnath Nagar Society, Nr. Sanghvi High School, Naranpura, Ahmedabad-380013 Also Residing at, 5/30 Vijaynagar Flat, Naranpura, Ahmedabad-380013	18.09.2023	11.12.2023	Nil	Rs 26,63,235.80	Rs. 42.00	Rs. 4.20	Rs. 42,000/-
Description of property : All that part and parcel of freehold immovable property bearing Office/Shop No FF-2 and FF-4 in Devi Vadaj association known as Divyalok medical Centre lying being and situated on the land of sub plot no 49-B of F.P. No 118 of T.P.S. No 28 of village Vadaj, Taluka city within district Ahmedabad and registration sub district of Ahmedabad held in the name of Shri Dineshsinh Kubersinh Zala (Deceased) Shop no.2 (4th floor) East: Marginal open space, West: Other property on Sub Plot No. 49/A, North: Passage stair and amalgamated with other office, South: Marginal open space, Shop no. 4 (1st floor) East: Passage and Margin then road, West: Common wall with stair portion of complex, North: Common wall with Shop-no. FF-3, South: Common wall with Shop-no. FF-5. Property owner: Mr. Dineshsinh Kubersinh Zala (deceased)		Name & Address of Branch PRAHLADNAGAR BRANCH 1-2, Riviera arcade, 100 Feet Road Near AUDA Garden, Prahladnagar, Ahmedabad, Phone No: (079) 26937295						
3	Borrower / Guarantor / Mortgagor : Borrower : M/s. Shree Ram Traders (Borrower), Prop. Mr. Barot Mukeshkumar Ramjibhai, 27 Priya Avenue, Plot 1308/1309, Phase 1 GIDC, Chhatral, Ta: Kalol, Dist: Gandhinagar-382721. Mr. Barot Mukeshkumar Ramjibhai (Proprietor & Mortgagor) S/o. Ramjibhai Barot, C17, Pruthvi Apartment, Vardhman Nagar, Kalol, Dist: Gandhinagar-382721	26.09.2023	06.12.2023	Nil	Rs. 15,75,089.23	Rs. 14.50	Rs. 1.45	Rs. 15,000/-
Description of property : All that piece & parcel of City Sy. No. 2245, 2246, 2247 of Amalgamated New City Sy. No. 2245 Paiki TPS NP 1, Final Plot No. 78, 79, 80 and Plot No. 78, Unit C-17, Ground Floor, construction 71.07 sq. mtrs., Pruthvi Apartment, Kalol, Dist: Gandhinagar (Gujarat) belonging to Mr. Barot Mukeshkumar Ramjibhai. Bounded by : East : Lift And Flat No. C-18, West : Staircase and Parking, North : Road and Compound Wall, South : Passage and Flat No. C-20		Name & Address of Branch KALOL BRANCH (38760) Shop No. 1, 2, Ground Floor, Riyansh Complex, Nr. City Mall, Ice Factory Road, Kalol-382721						
4	Borrower / Guarantor / Mortgagor : Borrower : 1. M/s. Silicon Jewel Industries Private Limited, Office Address: Shri Laxmi Saw Mill Compound, Near Odhav Approach Bus Stand, Odhav, Ahmedabad-382415 & Unit Address : S. No. 57 to 59, Near GIDC Industrial Estate, Nr. Beal Unit, Vill: Jitaley, Ankleshwar, Gujarat-393001. 2. Mr. Prakashbhai Mansukhbhai Patel (Director & Guarantor), R/o House No. 9, Parag Society, Opposite Mangalam Cinema, Odhav, Ahmedabad-382415. & R/o House No. 96, Nandan Bagh, Balasiya, Dehgam Road Circle, Ahmedabad-382345. 3. Mr. Vikas Kumar Pravinbhai Dholu (Director & Guarantor), R/o 4/479 Panchvati Society, Opposite V D Mehta Petrol Pump, Modasa Road, Sabarkantha, Gujarat-383215. 4. Mr. Arvind Bhai Vishrambhai Patel (Director & Guarantor), R/o No. 06, Nr. G E B Paras Society, Talod, Sabarkantha, Gujarat 383215 & R/o No. 3, Laxmi Nivas, Paras Soc., Nr. G E B, Talod, Sabarkantha, Gujarat 383215. 5. Mr. Mansukh Bhai Vashrambhai Patel (Director & Guarantor), R/o House No. 9, Parag Society, Opposite Mangalam Cinema, Odhav, Ahmedabad-382415. & R/o House No. 96, Nandan Bagh, Balasiya, Dehgam Road Circle, Ahmedabad-382345. 6. Mr. Praveenbhai Lalajibhai Patel (Director & Guarantor), R/o. 11, Parag Society, Nr. ADC Bank, Odhav, Ahmedabad, Gujarat-382415. 7. Mrs. Darshanaben P. Patel (Guarantor), R/o House No. 9, Parag Society, Opposite Mangalam Cinema, Odhav, Ahmedabad - 382415 & R/o House No. 96, Nandan Bagh, Balasiya, Dehgam Road Circle, Ahmedabad-382345.	04.09.2023	11.12.2023	Nil	Rs. 13,67,82,359.49	Rs. 365.00	Rs. 36.50	Rs. 3,65,000/-
Description of property : All that piece & parcel of All that piece and parcel of Immovable Property being Residential Land & Building bearing Bungalow/Plot No. 96 having land area 879.52 sq. mtrs. With construction thereon adm. about 355.35 sq. mtrs. In the society known as Nandanbaug (Bilasia) co. op. Housing Society Ltd. In the scheme known as "Nandanbaug Farm House", situated on land bearing block no. 129 of mouje village: Bilasia, Taluka Daskroi, District Ahmedabad, Sub Dist: Ahmedabad-7 (Odhav). bounded by : East : Plot No. 66, West : 9.00 mtr. Road, North : Block No. 142, South : Plot No. 95. Property Owner: Mr. Prakashbhai Mansukhbhai Patel		Name & Address of Branch Odhav Ring Road Branch Shop No. 32-35, Siddhivinayak Arcade, Odhav Ring Road Circle, Odhav, Ahmedabad						
5	Borrower / Guarantor / Mortgagor : Borrower : 1. M/s. Siddhi Apparels (Borrower) Prop.: Mrs. Pallaviben Himanshu Jani, A-59, Tirupati Industrial Estate, Milan Cinema Road, Saraspur, Ahmedabad 380018. 2. Mrs. Bhadraben Bhagwatiprasad Jani (Mortgagor & Co-obligant / Guarantor) W/o. Bhagavati Prasad Jani, House No. 3166, Vadvasi Mehta Ni Pole, Opp. Shahpur Municipal Hospital, Shahpur Chakia, Shahpur, Ahmedabad 380001. 3. Mr. Himanshu Bhagvati Prasad Jani (Co-obligant / Guarantor) S/o. Bhagavati Prasad Jani, House No. 3166, Vadvasi Mehta Ni Pole, Opp. Shahpur Municipal Hospital, Shahpur Chakia, Shahpur, Ahmedabad-380001. 4. Mr. Mochi Bhavari Lal Hanumanji (Co-obligant / Guarantor), First Floor/233, 711 Madhavapura, Gunj Bazar, Delhi Gate, Halthisingh's Wadi, Shahibagh Road, Ahmedabad-380016	04.07.2023	22.09.2023	Nil	Rs. 16,29,347.34	Rs. 7.60	Rs. 0.76	Rs. 8,000/-
Description of property : All that piece & parcel of all that undivided share in the piece and parcel of non-agricultural use land bearing City Sy. No. 5271 of Mouje Ward R. S Shahpur-2-C, Taluka City in the Registration District of Ahmedabad and Sub-District of Ahmedabad-1 (City) together with structure being House (Mun Cen Number) No. 3166 (Mun Tenament No. 0125-29-0326-0001-K) adm. 49.50 Sq. mtrs. With undivided share in land adm 16 sq. mtrs. Shahpur, Ahmedabad with right to use common plot, road etc. Property Owner: Mrs. Bhadraben Bhagwatiprasad Jani		Name & Address of Branch Chandkheda Branch (58180) Shop No. A/11, 12, 13, Sopan Complex, Chandkheda, Ahmedabad - 382424						

The property will be sold by holding public E-auction on **14.03.2024 (Thursday) from 12:00 PM to 04:00 PM** by inviting Bids from the public through online mode on www.mstcecommerce.com For registration, bidding and detailed terms & conditions, please visit the following website : <https://www.mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp>

STATUTORY 30 DAYS' NOTICE AS PER THE PROVISIONS OF SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002

Date : 07.02.2024, Place : Ahmedabad
 Sd/- Authorised Officer, Union Bank of India

પાર્ક હોટેલનો આઈપીઓ બિડિંગના છેલ્લા દિવસે ૫૯.૬૬ ગણો ભરાયો

પીટીઆઈ નવી દિલ્હી, તા. ૭

૫ પાર્ક બ્રાન્ડ હેઠળ હોટેલ્સ ચલાવતી અપીજય સુરેન્દ્ર પાર્ક હોટેલ્સની પ્રારંભિક જાહેર ઓફર બુધવારે બિડિંગના અંતિમ દિવસે ૫૯.૬૬ ગણી ભરાઈ હતી. એનએસઈના આંકડા પ્રમાણે રૂપિયા ૯૨૦ કરોડના આઈપીઓમાં ૩,૪૭,૬૧,૯૦૩ શેરોની માત્રા ૨,૦૭,૩૮,૨૩,૩૯૨ શેરોની બિડ્ડ આવી હતી. આઈપીઓમાં ક્વોલિફાઈડ ઈન્વેસ્ટરના બાયર્સનો (ક્યુઆઈબી) ક્વોટા ૭૫.૧૪ ગણો ભરાયો હતો, જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારોની કેટેગરી પર ૪૧ ગણી ભરાઈ હતી. જ્યારે છૂટક અને રૂપિયા ૩૨૦ કરોડ ઓફર ફોર સેલ દ્વારા ઈક્વિટીના શેરના વેચાણથી એક્ટ કરવામાં આવશે. આઈપીઓ માટે પ્રારંભિક રેન્જ પ્રતિ શેર રૂપિયા ૧૪૭થી ૧૫૫ નક્કી કરવામાં આવી છે. એક્ટ થયેલ ભંડોળનો ઉપયોગ કંપની દેવાની ચૂકવણી અને સામાન્ય કોર્પોરેટ હેતુ માટે કરશે.

SBI ભારતીય સ્ટેટ બેંક સરકારી કાયદા ૨૦૦૨ની કલમ ૧૩(૪) હેઠળ મિલકતોના સાંકેતિક કલબ અંગેની નોટિસ

સરકારી કાયદા ૨૦૦૨ની કલમ ૧૩(૪) હેઠળ મિલકતોના સાંકેતિક કલબ અંગેની નોટિસ

૧૯૦ માળ, રત્ના ટાઈમ્સ, ૪૨, સરદાર પટેલ નગર, ગીરીયા હોલ્ડિંગ્સ ચાર રસ્તા પાસે, ઓફ. સી. જી. રોડ, એલિસબ્રીજ, અમદાવાદ-૩૮૦૦૦૬.

આથી સિક્કોરીટાઈઝેશન એન્ડ રીફાઇન્સિંગ એન્ડ ફાઇનાન્સિયલ સેવિસીસ એન્ડ એન્જીનિયરિંગ એન્ડ સિક્કોરીટી ઈન્વેસ્ટમેન્ટ એન્ડ સિક્કોરીટી ઈન્વેસ્ટમેન્ટ (એન્જીનિયરિંગ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૩ સાથે વંચાતી કલમ ૧૩(૧૨) હેઠળ નોટીસ આપવામાં આવે છે કે હાલ સત્તાની રૂબરૂ નીચે જણાવેલા પાતાની સામે અને અર્થી નીચે જણાવેલા તારીખે માંગણ નોટીસ આપીને નીચે જણાવેલ દેવાદારોને કલિત નોટીસ મુજબની તારીખથી ૬૦ દિવસમાં તેમના નામ સામે જણાવેલ રકમ પર ચૂકવવા જણાવ્યું હતું.

દેવાદાર/જામીનદારો આ રકમ પર ચૂકવવામાં નિષ્ફળ ગયા હોવાથી, દેવાદાર/જામીનદાર અને જાહેર જનતાને આ નોટીસ દ્વારા જણાવવામાં આવે છે કે નીચે સર્કલ કરવાને પ્રત્યેક પાતાની સામે દર્શાવેલી તારીખે નીચે જણાવેલ મિલકતોનો સાંકેતિક કલબ સિક્કોરીટી ઈન્વેસ્ટમેન્ટ (એન્જીનિયરિંગ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૩ અને નિયમ ૮ સાથે વંચતી કલમ ૧૩(૪) હેઠળ તેમને/તેણીને મળી શકે તે પ્રત્યેક પાતાની સામે દર્શાવેલ તારીખે લઈ લેશે.

ખાસ કરીને નીચે જણાવેલ દેવાદાર/જામીનદારો અને જાહેર જનતાને આથી વેતણી આપવામાં આવે છે કે મિલકતો અંગે કોઈપણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં અને મિલકતો સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની નીચે દર્શાવેલ રકમ તથા તે પરના આગમી વ્યાજ, આકર્ષક ખર્ચ, મુદ્દલ, ચાર્જિસ સહિત કરશે.


સિક્કોરીટી મિલકતો હોડાવા માટે ઉપલબ્ધ રમચ અંગે કલબની કલમ ૧૩ની પેટા કલમ (૮)ની જોગવાઈનો પ્રત્યે દેવાદાર/જામીનદારોનું દ્યાન દોરવામાં આવે છે.

ક્રમ નં.	દેવાદારનું નામ અને સંબંધ	મિલકતના માલિકના નામ	બેંકને ડીરે / ચાર્જ કરાયેલ મિલકતોનું વર્ણન	કલબ નોટીસની તારીખ	કલબની તારીખ	કલબ રકમ (રૂ.માં)
1.	સોમની લાઈફ ઈર (પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ-શ્રીમતી હિંદુ ગોવિંદ ખંડેરાવ) સંબંધમાં : શેડ નં. ૫૬, જયામ એસ્ટેટ - ફેઝ ૧, એચએસઈફ ફર્નિચર સિસ્ટમ મા. ડી. ની પાછળ, ચાંગોદર, અમદાવાદ-૩૮૨૨૧૩	સોમની લાઈફ ઈર (દેવાદાર)	મશીનરી, કારો માલ, વર્ક-ઇન-પ્રોગ્રેસ, ફિનિશ્ડ ગુરુડ, મળવાવાત્ર અને અન્ય તમામ મિલકતો જે બેંકના ફાઇનાન્સમાંથી હસ્તગત કરવામાં આવી છે	16-11-2023	02-02-2024	રૂ. ૫૩,૪૬,૩૨૨.૫૨ (રૂપિયા ત્રેપ્પલ લાખ અગ્રણ્યકોસ હપ્તર પ્રણોસ બાણુ અને વાવળ પેસા) તા. ૧૫.૧૧.૨૦૨૩ સુધીના અને આગામી વ્યાજ, મુદ્દલ, ચાર્જિસ વગેરે
2.	મેક યુ કોસ્મેટીક્સ (પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ-શ્રી એલલ ભરતભાઈ ભાવસાર) સંબંધમાં : જીને માળ, પ્લોટ નં. ૧૭-એ, "વી2 હાઉસ", શ્રીલાલજી એસ્ટેટ, ચાંગોદર, અમદાવાદ, ગુજરાત-૩૮૨૨૧૩	મેક યુ કોસ્મેટીક્સ (દેવાદાર)	મશીનરી, કારો માલ, વર્ક-ઇન-પ્રોગ્રેસ, ફિનિશ્ડ ગુરુડ, મળવાવાત્ર અને અન્ય તમામ મિલકતો જે બેંકના ફાઇનાન્સમાંથી હસ્તગત કરવામાં આવી છે	16-11-2023	02-02-2024	રૂ. ૪૪,૨૪,૭૮૫.૧૦ (રૂપિયા ચતુર્દશ લાખ એકઠવીસ હપ્તર સાતસો પંચાસી અને સારસ પેસા) તા. ૧૫.૧૧.૨૦૨૩ સુધીના અને આગામી વ્યાજ, મુદ્દલ, ચાર્જિસ વગેરે
3.	શ્રી કાલુજી દિલીપભાઈ પટેલ અને શ્રીમતી પુષ્પાબેન દિલીપભાઈ પટેલ સંબંધમાં : સી-૭-૧૨, પેરાડાઈસ ફ્લેટ, શાહીબાગ, હોટેલ સિદ્ધાર્થ પદાગ્ર પાસે, અમદાવાદ, ગુજરાત-૩૮૦૦૦૪	શ્રી કાલુજી દિલીપભાઈ પટેલ અને શ્રીમતી પુષ્પાબેન દિલીપભાઈ પટેલ (દેવાદાર)	મંગલવા નં ૨૦ આશરે ૧૫૭.૯૪ ચો.મી. પ્લોટ એરીયા કોમ્પાઉન્ડ રોડ વગેરે સહિત માં અવિભાજ્ય હિસ્સા સહીત બાંધકામનો સુલ વિસ્તાર ઝાઉલ્ડ ફ્લોર, પ્રથમ માળ અને સીડી કેવીન આશરે ૧૯૭.૯૩ ચો.મી સ્કીમ સંતવીલા આવેલ છે સર્વે/વ્લોક નં. ૧૮૭ ગામ મંજીપુરા, તાલુકો નડીયાદ, ડીસ્ટ્રીક્ટ અને સળ ડીસ્ટ્રીક્ટ ખેડા, ગુજરાત રાજ્ય	17-11-2023	05-02-2024	રૂ. ૭૦,૭૬,૬૮૩.૯૨ (રૂપિયા સીતર લાખ અગ્રણ્યકોસ હપ્તર છસો વ્યાંસી અને બાણુ પેસા) તા. ૧૫.૧૧.૨૦૨૩ સુધીના અને આગામી વ્યાજ, મુદ્દલ, ચાર્જિસ વગેરે

તારીખ : ૦૨-૦૨-૨૦૨૪ સ્થળ : અમદાવાદ

સહી/ અધિકૃત અધિકારી, ભારતીય સ્ટેટ બેંક, એક્સપ્રેસ ઓફિસ, અમદાવાદ.

નોંધ : વિવાદની સ્થિતિમાં આ નોટીસની અંગેજી અનુવાદ માન્ય ગણવામાં આવશે.



STATEMENT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER & NINE MONTHS ENDED 31ST DECEMBER, 2023

(₹ In million)

Sr. No.	Particulars	Quarter ended 31-12-2023	Quarter ended 30-09-2023	Quarter ended 31-12-2022	Nine Months ended 31-12-2023	Nine Months ended 31-12-2022	Year ended 31-03-2023
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total Revenue from Operations	1,400.74	1,400.95	1,051.40	4,121.89	3,186.67	4,609.38
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional)	400.99	297.78	126.43	1,125.15	701.98	1,234.87
3	Net Profit/(Loss) for the period before Tax, (after Exceptional)	400.99	297.78	126.43	1,125.15	701.98	1,234.87
4	Net Profit/(Loss) for the period after Tax (after Exceptional)	297.87	238.84	95.18	821.82	516.28	898.57
5	Total Comprehensive Income for the period (comprising Profit/(Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after tax)	300.57	237.46	94.92	837.71	508.36	886.00
6	Equity Share capital	160.97	160.97	160.97	160.97	160.97	160.97
7	Other Equity	7,623.04	7,370.76	6,453.32	7,623.04	6,453.32	6,833.62
8	Earning per share (of ₹10/- each) (not annualized)						
	1. Basic	3.70	2.97	1.18	10.21	6.41	11.16
	2. Diluted	3.70	2.97	1.18	10.21	6.41	11.16

Notes:

a) The Financial Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 07th February, 2024. The Auditors of the Company have carried out Limited Review of the Unaudited Financial Results for the Quarter & Nine Months Ended 31.12.2023.

b) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the websites (www.bseindia.com), (www.nseindia.com) and Company's website (www.supriyalifescience.com)

For Supriya Lifescience Limited
Sd/-
Dr. Satish Waman Wagh
Chairman & Managing Director
DIN: 01456982

Place: Mumbai
Date: 07-02-2024

SUPRIYA LIFESCIENCE LIMITED

CIN: L51900MH2008PLC180452

207/208, Udyog Bhavan, Sonawala Road, Goregaon (East), Mumbai - 400063.

Tel. No.: +91 22 40332727; E-mail: cs@supriyalifescience.com; Website: www.supriyalifescience.com

AXIS BANK

સ્ટાલર મિલકતના વેચાણ માટે ઈ-હરાજી વેચાણ નોટીસ

સિક્કોરીટાઈઝેશન એન્ડ રીફાઇન્સિંગ એન્ડ ફાઇનાન્સિયલ સેવિસીસ એન્ડ એન્જીનિયરિંગ એન્ડ સિક્કોરીટી ઈન્વેસ્ટમેન્ટ એન્ડ સિક્કોરીટી ઈન્વેસ્ટમેન્ટ (એન્જીનિયરિંગ) નિયમ - ૨૦૦૨ ના નિયમ ૮(૬) ની જોગવાઈ સાથે વેચાણ લેતાં

આથી જાહેર જનતાને સામાન્ય રીતે અને ખાસ કરીને ઉદારકર્તાઓ અને જામીનદારોને સુધવા આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ સ્થાવર મિલકત સુરક્ષિત વેચાણ પાસે મોર્ગેજ/જાહેર કરવામાં આવી છે, જેનો પ્રત્યક્ષ કબજો (નીચે વિગતવાર તરીકે) અધિકૃત અધિકારી દ્વારા લેવામાં આવ્યો છે. "જેમ છે ત્યાં" "જેમ છે તેમ" અને "જે છે તે" પર પ્રિક્ષકો કરી શકે તેવા વેચાણ કરવામાં આવશે જેમાં તા. ૨૭.૦૨.૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ થી બપોરે ૧૨ વાગ્યા સુધી (બીડ સબમીશન કરવાની છેલ્લી તારીખ અને સમય તા. ૨૬.૦૨.૨૦૨૪ ના રોજ સાંજે ૩:૦૦ વાગ્યા સુધી) નીચે દર્શાવેલ સંબંધિત ઉદારકર્તાઓ અને જામીનદારો પાસેથી એકિસ બેંક સુરક્ષિત વેચાણને કારણે રકમની વ્યવસ્થા માટે (સંબંધિત કોલમમાં નીચે દર્શાવેલ છે). સંબંધિત કોલમમાં નીચે જણાવ્યા પ્રમાણે મિલકતોની અનામત કિંમત અને ઈએમપી ની રકમ.

ક્ર. નં.	ઉદારકર્તા, મોર્ગેજરનું નામ અને સાખા	મિલકત / મકાનનું વર્ણન / આશરે કુલ વિસ્તાર	અનામત કિંમત	ઈએમપીની કિંમત	બીડ વધારવા ની રકમ	બાકી લેણીની રકમ	સંપર્ક વ્યક્તિ
1.	મેસર્સ વી.આઈ. પટેલ અને કંપની (સામૂહિક) 2. જાનુઆરી ઈન્વેસ્ટમેન્ટ પટેલ (બાબીદાર/મોર્ગેજર) 3. વિજયભાઈ પટેલ (બાબીદાર/મોર્ગેજર) 4. રેખાબેન વિજયભાઈ પટેલ (મેસ્ટર/મોર્ગેજર) (બીન એક્ટીવ નંબર 91403000774350)	રેખાબેન વિજયભાઈ પટેલ અને કમલ વિજયભાઈ પટેલ નો તમામ ભાગ અને હિસ્સા સાથે નો પ્લોટ નં. 20, નેનો સિટી સર્વે નં. 2159, મેલકા 33૮.૪૪ સ્પષ્ટ મોટર વાણાની જમીન સાથે મળીને તેનું શેવડા ૧૩૩.૧૯ સ્પષ્ટ મોટર, મુકુબા કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિ., આર.એસ. નં. ૬૪ અને 7/બે-1-1-1, ટી.પી. ચોખા નં. 5, એફ. પી. નં. 112, સિટી સર્વે વોર્ડ નં. 13, સિટી સર્વે નં. 237, 238/એ, અને 239/બી, ચામ અલવા, પેટા જિલ્લા ચોખા, જિલ્લા સુલ ધરાવતી જમીન પર આવેલી છે.	3. 4,72,00,000/- (રૂપિયા ચાર કરોડ બોતર લાખ પુર) 3.	3. 47,20,000/- (રૂપિયા સુડાતાવીસ લાખ વીસ હજાર પુર)	3. 1,00,000/- (રૂપિયા એક લાખ ખમ ગુણાકારમાં)	3. 5,28,48,083.17/- (રૂપિયા પાંચ કરોડ અઠ્ઠાવીસ લાખ અડતાલીસ હજાર ત્રણસો અને સત્તર પેસા 12-01-2019 ના રોજ બાકી નોકાતી રકમ છે (આ રકમમાં 30-04-2019 સુધી લાગુ વ્યાજનો સમાવેશ થાય છે))	નામ :- શ્રી દર્શન ત્રિવેદી મોબાઇલ નંબર:- +91-9978953003 ઈ-મેઇલ આઈડી:- darshan.trivedi@axisbank.com અથવા નામ :- શ્રી સાગર કોટેચા મોબાઇલ નંબર:- +91-9909799027 ઈ-મેઇલ આઈડી:- sagar.kotcha@axisbank.com

વેચાણના વિસ્તૃત નિયમો અને સરતો માટે, કૃપા કરીને તેમના વેબ પોર્ટલ પર સુરક્ષિત વેચાણની વેબસાઇટ એટલે કે <https://www.axisbank.com/auction-retail> અને બેંકની માન્ય સેવા પ્રદાતા મેસર્સ સી1 ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં પુરી પાડવામાં આવેલી વિક્રમી સંદર્ભ લે <https://www.bankauctions.com> આ વચ્ચે બેંકની માન્ય પ્રદાતા મેસર્સ સી1 ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મારફતે તેમના વેબ પોર્ટલ <https://www.bankauctions.com> પર ઓન-લાઇન લાઇ થયવામાં આવશે. અન્ય કોઈ પણ સહાય માટે, ઇચ્યુક બિડ્સ સવારે 11:30 થી બપોરે 3:00 વાગ્યા ની વચ્ચે અધિકૃત અધિકારીઓની નીચે સંપર્ક કરી શકે છે. બિડ ટુઅફરબલ નથી. આ નોટિસને સુરક્ષા હિત (અમલ બજાવણી) નિયમ, 2002 ના નિયમ 8(6) હેઠળ ત્રણવેનાસંખ્યોને 15 દિવસની નોટિસ તરીકે ધ્યાનમાં લેવી જોઈશે.

તારીખ : 08.02.2024, સ્થળ : ગુજરાત

નોંધ : (વિવાદ ની સ્થિતિમાં અંગેજી આવૃત્તિને માન્ય ગણવામાં આવશે)

અધિકૃત અધિકારી, એકિસ બેંક લિ.

SHALBY LIMITED

Regd. Office : Shalby Multi-Specialty Hospitals, Opp. Karnavati Club, S. G. Road, Ahmedabad 380015, Gujarat, India • Tel: 079 40203000 • Fax: 079 40203120
E-mail: companysecretary@shalby.in website: www.shalby.org CIN: L85110GJ2004PLC04667

SHALBY LIMITED
LIMITED
"Passion • Compassion • Innovation"

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED DECEMBER 31, 2023

(₹ in million, except per share data)

Sr. No.	Particulars	Standalone		Consolidated			
		Quarter ended		Quarter ended			
		31/12/2023	31/12/2022	31/12/2023	31/12/2022		
1	Total income from operations	1,951.53	1,758.67	6,233.60	2,160.47	2,024.60	6,895.16
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	384.79	285.58	1,257.94	308.11	235.35	1,064.12
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	384.79	285.58	1,257.94	308.11	235.35	1,064.12
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	247.24	191.95	812.85	190.64	152.73	674.59
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	247.88	191.21	814.78	190.65	153.15	673.61
6	Paid-up Equity Share Capital (Face Value ₹ 10/- each) (Net of Treasury Shares)	1,073.53	1,073.10	1,073.53	1,073.53	1,073.10	1,073.53
7	Reserves (excluding Revaluation Reserve)	-	-	-	-	-	-
8	Earnings Per Share (Face Value of ₹ 10/- each) (not annualized)						
	(i) Basic EPS	2.30	1.79	7.57	1.78	1.42	6.28
	(ii) Diluted EPS	2.30	1.78	7.57	1.78	1.41	6.28

Notes:

1. The above is an extract of the detailed format of unaudited financial results for the quarter ended December 31, 2023, filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Standalone and Consolidated Financial Results for the quarter ended December 31, 2023 are available on the websites of the Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com and on the Company's website at www.shalby.org.

For and on behalf of Board of Directors
Dr. Vikram Shah
Chairman and Managing Director
DIN: 00011653

Place: Ahmedabad
Date: February 7, 2024

CAMEX LIMITED

CIN : L17100GJ1989PLC013041

Registered Office: Camex House, 2nd Floor, Stadium- Commerce Road, Navrangpura, Ahmedabad-380009.
Tel: +91-79-26462123 • Fax: +91-79-26462260 • Email: cs@camexltd.com • Website: www.camexltd.com

Extract of Unaudited Financial Results for the Quarter and Nine Months ended December 31, 2023

(All Amounts in INR Lakhs, unless otherwise stated)

Sr. No.	Particulars	Financial Results					
		Quarter Ended			Nine Months Ended		
		31-12-23	30-09-23	31-12-22	31-12-23	31-12-22	31-03-23
1	Total Revenue from operations (net)	3489.00	3565.61	3068.02	10,504.53	9,282.70	13,380.45
2	Net Profit / (Loss) for the period (before Tax and Exceptional items)	154.24	125.74	(50.52)	255.14	4.70	86.34
3	Net Profit / (Loss) for the period before Tax (After Exceptional items)	154.24	125.74	(50.52)	255.14	4.70	86.34
4	Net Profit / (Loss) for the period after Tax (After Exceptional items)	116.32	99.25	(44.07)	191.09	(0.58)	61.14
5	Total Comprehensive Income for the period	-	-	-	-	-	1.84
6	Paid up Equity Share Capital (Face value of Rs.10 each)	1020.87	1020.87	1020.87	1020.87	1020.87	1020.87
7	Reserve (excluding Revaluation Reserves) as per Balance sheet of previous accounting year	-	-	-	-	-	2,730.19
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -						
	Basic	1.14	0.97	(0.43)	1.87	(0.01)	0.62
	Diluted	1.14	0.97	(0.43)	1.87	(0.01)	0.62

Notes:

1. These financial results were reviewed by the Audit Committee, and were approved by the Board of Directors and taken on record by the Board of Directors at their meeting held on February 07, 2024.

2. The above results for the quarter and nine months ended on December 31, 2023 has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS), prescribed under Section 133 of the Companies Act, 2013, and other recognised accounting practices and policies to the extent applicable. The format of the unaudited quarterly and year-to-date results as prescribed in SEBI's Circular CIR/CFD/CMD/15/2015 dated 30th November, 2015 has been modified to comply with the requirements of SEBI's Circular dated 5th July, 2016, IndAS and Schedule III [Division II] to the Companies Act, 2013.

3. The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results is available on the websites of the Stock Exchanges, www.bseindia.com and on the Company website www.camexltd.com.

For and on behalf of the Board
CAMEX LIMITED
Sd/-
Chandraprakash Chopra
Managing Director (DIN:00375421)

Place : Ahmedabad
Date : 07/02/2024